


## હોટ વર્ક પહેલાં એલએફઅલ નું પરીક્ષણ ક્યાં કરશો ?

ઓગસ્ટ ૨૦૨૦



હોટવર્ક નું કામ શરૂ કરતાં પહેલાં અને દરમિયાન એલએફઅલ ને ચકાસવાની જગ્યોએ

જગ્યાનું વર્ષોથી આપણી ઈન્ડસ્ટ્રીયામાં હોટવર્ક દરમિયાન ઉત્પન્ન થતાં તણખાઓ સણગતાં આગ ને વિસ્ફોટની ઘણી ઘણી ઘટનાઓ બનેલી છે. મે ૨૦૨૦નું બેકનમાં આવી એક ઘટનાને કારણે થયેલ ઘટાતક પરીક્ષામો ને આવરી લીધા હતાં. હોટ વર્ક માટેની તૈયારી નું એક પગણું એ છે કે ઉપ કૂટ \* (૧૦.૭ મીટર) ની ગ્રીજામાં સણગી શકે તેવો પદાર્થ અને/અથવા જવલનશીલ વરાળનું હાજર હોવાનું પરીક્ષણ કરવું. અને તેને અટકાવવું.

(\* અમેરિકી ઓએસએચએ અને રાષ્ટ્રીય આગ સંરક્ષણ સંગઠન (અનેફીપીએ) બંને દ્વારા બલામણ કરાયેલ અંતર).

ઘણી કંપનીઓ જવલનશીલ વરાળનું એવી બધી જગ્યાએ પરીક્ષણ કરે છે કે જગ્યાનું હોટવર્ક ને કારણે તણગાં ઓ ઉડી શકે. ઉપરની આકૃતિ તપાસવાની આવી કેટલીક જગ્યાઓ દર્શાવે છે. હોટવર્ક ચાલતું હોય તે જગ્યાએ એલએફઅલ ગેસ ડીટેક્ટરના રીડીંગને માપવું જરૂરી છે, ઉપરાંત આજૂબાજૂમાં અને નીચે એવી બધી જગ્યાં એ જગ્યાનું પણ ગરમ તણગાં ઓ જઈ શકે. જેમાં સામેલ છે પ્રોબ ના ઉપયોગથી (અથવા સેમપલીંગ હોઝ વડે) ખુલ્લી પ્રક્રીયા પાઈપો અથવા સમ્બન્ધીની અંદર અને પ્રક્રિયા ગટર જેમ કે પોર્ટન્ટ પ - એ.

## શું તમે જાણો છો ?

- ગેસ-કટીંગ, વેલ્ડીંગ અને ગ્રાઇન્ડિંગ માંથી નીકળતાં તણખાઓ ઘણે દૂર સુધી જઈ શકે છે. આ કારણે જ ઘણી પરમીટો માં ઉપ કૂટ (૧૦.૭ મી.) સુધી સણગી ઉઠ તેવા પદાર્થો ને દુર કરવા અને જવલનશીલ ગેસનું પરીક્ષણ કરવાનું કહેવાયું છે.
- ગુરુત્વાક્ષરણને કારણે તણગાં અને ગરમ કણો જમીન ઉપર પડી શકે છે – અને તે ખાડા અને સમ્પન્મુખ પણ પડી શકે છે. જગ્યાનું ઉચાઈએ હોટ વર્ક થતું હોય તો તેની નીચે એલએફઅલ ની દેખરેખ કરવી જોઈએ.
- મોટામાં જવલનશીલ વરાળો, હવા કરતાં ભારે હોય છે જેથી તે નીચેની જગ્યાએ ભેગી થતી હોય છે, જેમાં ગટર અને સમ્પન્મુખ પણ સામેલ છે.
- હલકી જવલનશીલ વરાળો પણ ઓછી વેન્ટીલેશનવાળી જગ્યામાં લાંબો સમય રહી શકે છે – જેમ કે પાઈપ, સાધનો અથવા બંધ દિવાલો ની અંદર.
- કિકેદારો અને મેન્ટનેન્સ ના કામદારો તમારી પ્રક્રિયા વિશે જાણતા નથી હોતા. તેઓ જવલનશીલ વરાળો ને શોધવાની બધી જગ્યાઓ વિશે જાણતા નથી હોતા.
- જ્યારે હોટવર્કની કામગીરી ચાલતી હોય ત્યારે પરીક્ષણિત બદલાઈ શકે છે. પ્રક્રિયા કામગીરી, અપસેટસ અથવા તો હવામાનની પરીક્ષણિત પણ જગ્યાનું હોટવર્ક ચાલતું હોય તેની નજીક જવલનશીલ પદાર્થને દાખલ કરી શકે છે.

## તમે શું કરી શકો ?

- ઉપ કૂટ (૧૦.૭મીટર)માં અથવા ઘંટ આકારમાં અથવા તમારી કંપની એ નિર્દિશીત અંતર માં સમાવિષ્ટ બધાં જ ખુલ્લાં ઢાંખણાંઓ અને સમ્પન્મુખ ને તપાસો.
- કેટલીક કંપનીઓ વારંવાર એલએફઅલ ની તપાસ કરતી હોય છે જેથી બદલાતી પરિસ્થિતિ સામે તૈયારી રાખી શકાય. સુરક્ષિત પરિસ્થિતિ ને જાળવવા અસરગ્રસ્ત વિસ્તારની દેખરેખ રાખો.
- તમારા પ્રક્રિયાના અનુભવનો ઉપયોગ કરીને વિચારો કે જવલનશીલ વરાળો અને સણગી શકે તેવા પ્રવાહી અને પદાર્થો કઈ જગ્યાએ હાજર હોઈ શકે.
- તમારા ગેસ ડીટેક્ટર સાથે આવેલી લાકડી અથવા તો નમુનાની નણી નો ઉપયોગ કરીને જગ્યાની અંદર ની તપાસ કરો.
- વેલ્ડીંગ બ્લેનકેટ અને બીજા સંરક્ષણ સાધનોનો ઉપયોગ તણગાં અને રજક્ષણો ને જ જગ્યાઓમાં તેની જરૂર નથી ત્યાં આવતા રોકવા માટે કરો. પણ ખાતી તેની ઉપર જ ભરોસો ન રાખો !

**એવી બધી જ જગ્યા ને તપાસો, જગ્યાનું જવલનશીલ વરાળો સણગી શકે !**